



**SB-0147**

**Second Year B. A. Examination  
March / April – 2011  
History of Science (ID)**

Time : 3 Hours]

[Total Marks : 70

**સૂચના :**

(૧)

નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.  
Fillup strictly the details of signs on your answer book.

Name of the Examination :

• **S. Y. B. A.**

Name of the Subject :

• **History of Science (ID)**

Subject Code No. : **0 1 4 7** • Section No. (1, 2,....) : **Nil**

Seat No. :

--	--	--	--	--	--

Student's Signature

- (૨) પ્રશ્ન નં. ૧ ફરજિયાત છે.  
(૩) જમણી બાજુ દર્શાવેલા અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

- ૧ નીચેનાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો : ૧૦  
(૧) ઔદ્યોગિક કચરો એટલે શું ?  
(૨) ગુરુત્વાકર્ષણ અને સાપેક્ષવાદ અંગે સંશોધન કરનાર વૈજ્ઞાનિકોનાં નામ જણાવો.  
(૩) આનુવંશિકતા એટલે શું ? આનુવંશિક લક્ષણોનાં વાહકનાં નામ જણાવો.  
(૪) માનવ કલ્યાણ અર્થે થતા પરમાણુ શક્તિનાં ઉપયોગો જણાવો.  
(૫) સૂર્યશક્તિનાં બે ઉપયોગો જણાવો.
- ૨ પર્યાવરણ એટલે શું ? કુદરતી પરિસ્થિતિકીય સમતોલનમાં માનવસર્જિત દખલ સંવિસ્તર સમજાવો. ૧૨

**અથવા**

- ૨ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસનું માનવજીવનમાં મહત્વ સમજાવો. ૧૨

- ૩ ગેલેલિયો, જેમ્સવોટ પર વિસ્તૃત નોંધ લખો. ૧૨

**અથવા**

- ૩ વોટ્સન કીક અને લૂણી પાશ્વરનું પ્રદાન વર્ણવો. ૧૨

**SB-0147]**

**1**

**[Contd...**

- ૪ અણુવિજ્ઞાનના ક્ષેત્રે ભારતને સ્વાવલંબી બનાવવા ડૉ. વિકિમ સારાભાઈનાં  
પ્રયત્નો વર્ણવો. ૧૨

**અથવા**

- ૪ સંસ્કૃતિ વિજ્ઞાન અને પારંપરિક વિજ્ઞાન અંગેનાં તમારા વિચારો જણાવો. ૧૨

- ૫ ટેકનોલોજી અને સંસ્કૃતિ વચ્ચેનો તશીવત સમજાવો. ૧૨

**અથવા**

- ૫ આધુનિક ભौતિક વિજ્ઞાનના વિકાસમાં પર આઈઝેક ન્યૂટન અને  
આઈન્સ્ટાઈનના સંશોધનોનું મહત્વ સમજાવો. ૧૨

- ૬ ગમે તે બે વિશે ટૂંકી નોંધ લખો : ૧૨

- (૧) જૈવ વૈવિધ્ય
- (૨) ઔદ્યોગિક કાંતિનાં પરિણામો
- (૩) જંગલોનાં વિનાશ માટે જવાબદાર કારણો
- (૪) સજીવો પર પ્રદૂષણાની અસર.

## **ENGLISH VERSION**

**Instructions :** (1) As per the instruction No 1 of page no. 1  
(2) Question No. 1 is **compulsory**.  
(3) Figures on the right indicate total marks of the question.

- 1 Answer the following questions in brief : 10

- (i) What is Industrial waste ?
- (ii) Name the scientists who established the theory of gravitation and theory of relativity.
- (iii) What is heredity ? Name the carriers of hereditary characters.
- (iv) Give the uses of atomic energy aimed for human well being.
- (v) Give two uses of solar energy.

- 2 What is environment ? Explain in detail the interference in natural ecological balance caused by man. 12

**OR**

- 2 Explain the importance of development of science and technology in human life. 12

- 3 Write detailed notes on Galelio, James Watt. **12**
- OR**
- 3 Describe in detail the contribution of Wotson, Creek and Louis Pasteur. **12**
- 4 Describe the attempts made by Dr.Vikram Sarabhai to make India self reliant in Atomic sciences. **12**
- OR**
- 4 Enumerate your ideas on cultural science and traditional science. **12**
- 5 Explain difference between technology and culture. **12**
- OR**
- 5 Describe in detail the contribution and importance of researches of Einsten and Newton in development of modern physics. **12**
- 6 Write any **two** short notes : **12**
- (i) Biodiversity
  - (ii) Results of industrial revolution
  - (iii) The reasons responsible for forest exploitation
  - (iv) Effect of pollution of living organisms.
-